

તમામ રહેવાસીઓને સંબોધન! બ્રામ્પટનમાં વસંતઋતુની સફાઈનો સમય આવ્યો છે

વસંતની સફાઈ, ક્યરો નહીં (ડોન્ટ બી ટ્રેશી)! ઝુંબેશ અને સ્ટ્રીટ સ્વીપિંગ પ્રોગ્રામ એપ્રિલ 1 થી શરૂ થાય છે.

બ્રામ્પટન, ઓન્ટેરિયો (એપ્રિલ 1, 2019) – બરફ પીગળવાની અને ઉષ્ણતામાન વધવાની સાથે, વસંતઋતુનું આગમન હવે ઔપચારિક રીતે થઈ ગયું છે. પરંતુ તેનો અર્થ ગંદવાડોનો પણ થાય છે જે મહિનાઓથી ધૂપાયેલો હતો તે હવે જમીનની સપાટી પર ઊભરી રહ્યો છે. શહેરી કર્મચારીગણ આગામી અઠવાડિયાઓમાં પાર્ક્સ અને સ્ટ્રીટ્સ સાફ કરવામાં કાર્યરત રહેશે ત્યારે, દરેક વ્યક્તિએ આ વસંતમાં આપણાં શહેરને સાફ રાખવામાં ભૂમિકા ભજવવાની રહે છે.

વસંતઋતુમાં સફાઈ: એપ્રિલ 1 થી 30

વાર્ષિક વસંતઋતુ દરમિયાન સફાઈ કામગીરી એપ્રિલ 1 થી 30 રહેવાસીઓને પોતાની મિલકતો, પાડોશ અને સ્થાનિક પાર્ક્સ સુઘડ રાખવા પ્રોત્સાહિત કરે છે.

તમે તમારા પોતાના સફાઈ કામની આગેવાની કરવા સ્વયંસેવક બની શકો છો અથવા સંગઠિત સફાઈ દિવસોમાંથી એકમાં જોડાઈ શકો છો. તમામ જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવશે. આયોજનોનું સંપૂર્ણ સમયપત્રક જોવા – અને ભાગ લેવા નોંધણી કરાવવા – વેબસાઈટ જુઓ, brampton.ca/springcleanup.

ક્યરો નહીં (ડોન્ટ બી ટ્રેશી)!

વસંત દરમિયાન સફાઈ કાર્યક્રમને ટેકો આપવામાં, આપણું શહેર ક્યરો નહીં (ડોન્ટ બી ટ્રેશી)! ઝુંબેશ શરૂ કરી રહ્યું છે, જેનો હેતુ ગંદવાડો પ્રત્યે જાગૃકતા સુધારવાનો, યોગ્ય ક્યરો નિકાલને પ્રોત્સાહન આપવાનો અને આપણાં શહેરમાં ગંદવાડાનું પ્રમાણ ઘટાડવાનો છે.

આ ઝુંબેશ ચોખ્ખા અને હરિયાળા બ્રામ્પટન પ્રત્યે આપણાં શહેરની અવિરત કટિબદ્ધતાનો ભાગ છે, ગંદવાડોના માનવ આરોગ્ય, વન્યજીવન અને કુદરતી પર્યાવરણ પર નકારાત્મક પ્રભાવને લગતી વધતી જતી ચિંતાઓને સંબોધવામાં. ક્યરો નહીં! ઝુંબેશ ઓક્ટોબરમાં પાનખર દરમિયાન સફાઈ કાર્યક્રમના અંત સુધી ચાલે છે.

આ ઝુંબેશના ભાગ તરીકે, આપણું શહેર શાળાઓ માટે ગંદવાડો સફાઈ પડકાર ચલાવી રહ્યું છે. જે વર્ગ એપ્રિલમાં મહત્તમ સંખ્યામાં સફાઈ પૂરી કરે અને પોતાના કામના ફોટો [@BramGrowGreen](https://twitter.com/BramGrowGreen) મોકલીને ટૂવીટ કરે, તેઓ વૃક્ષારોપણ આયોજનના વિજેતા બનશે. વધુ માહિતી માટે વેબસાઈટ જુઓ, brampton.ca/growgreen.

સ્ટ્રીટ સ્વીપિંગ

શહેરી કર્મચારીગણ રેતી અને સમગ્ર શિયાળામાં જામેલો ક્યરો હટાવવા જલદી સ્ટ્રીટ્સ વાળવાનું શરૂ કરશે. સ્વીપિંગ મે મહિનાના અંત સુધી ચાલુ રહેશે, જો હવામાન સારું રહે. વધુ માહિતી મેળવવા વેબસાઈટ જુઓ, brampton.ca/streetsweeping.

અવતરણ (ક્વોટ):

“પાર્કની બેન્ચ પર છોડી દીધેલો કોફીનો કપ હોય કે કારની બારીમાંથી બહાર ફેંકેલું સિગારેટનું ટૂંટું હોય, ગંદવાડો ઊભો થતો હોય છે અને તેનો આપણાં પર્યાવરણ, આપણાં વૉલેટ્સ અને આપણાં સમુદાય વિશે આપણી અનુભૂતિની રીત પર ગંભીર પ્રભાવ પડે છે. આપણાં સૌની જવાબદારી આપણાં શહેરનું સંરક્ષણ કરવાની, શહેરને સૌ માટે યોજ્યું અને આનંદ માણવાલાયક હરિયાળુ રાખવાની ખાતરી કરવાની છે – અને તે બધું તમારા કચરાને કચરાપેટીમાં નાખવાથી શરૂ થાય છે, જ્યાં કચરો હોવો જોઈએ. આ વર્ષની વસંત સફાઈ પહેલ દરેક વ્યક્તિ માટે સામેલ થવાની અને એક તફાવત ઊભો કરવાની એક ચરિયાતી રીત છે.”

- મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown)

-30-

સીટી ઓફ બ્રેમ્પટન વિશે વિધે વધુ માહિતી માટે અહીં મુલાકાત લો www.brampton.ca અમને ફોલો કરો [Twitter](https://twitter.com/brampton) પર, [Facebook](https://www.facebook.com/brampton) પર, અને [Instagram](https://www.instagram.com/brampton) પર.

મિડિયા સંપર્ક:

મોનિકા દુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca